



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૨/૧૨/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૦૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૧ કેસ કરી, ૩૭ વ્યક્તિઓને ઝડપી, ૯૧ લીટર દેશી દારૂ, ૮૭ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૯૨ બિયર ટીન, ૧ સ્ફૂટર અને ૧ રિક્ષા કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૯૭૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૪૦૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૨૪૦૭/૧૮

વાસણા: આકાશભાઈ રમેશભાઈ રાઠોડ (રહે. મીત્તલ એપાર્ટમેન્ટ મલાવ તળાવની સામે જીવરાજપાર્ક વાસણા) એ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૧૨/૧૮ સવારના ૧૧/૦૦ થી બપોરના ૧/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોનાના અલગ-અલગ દાગીનાઓ (૧) સોનાનું મંગળસુત્ર નંગ-૧ કિમત રૂપિયા ૨૭,૫૦૦/- (૨) સોનાની ચેઇન પેડલ સાથે કિમત રૂપિયા ૯૫,૦૦૦/- (૩) સુર્યનું પેડલ તથા એક ઓમનું પેડલ કિમત રૂપિયા ૨૫,૦૦૦/- (૪) ચાંદીના વેઢ નંગ-૪ કિમત રૂપિયા ૫૦૦૦/- (૫) સોનાની યુની નંગ-૧ કિમત રૂપિયા ૨,૦૦૦/- અને (૬) સોનાની વીટી નંગ-૧ કિમત રૂપિયા ૧૨,૦૦૦/- મળી કુલ કિમત રૂપિયા ૧,૬૬,૫૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.જે.વાળા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૪૦૮/૧૮

વાડજ: શ્રદ્ધાબહેન ત્રિલોકભાઈ બેન્કર (રહે.મગનલાલ પાર્ક સોસાયટી રાઘાસ્વામી રોડ રાણીપ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧/૧૦/૧૮ કલાક ૧૦/૩૦ થી ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન નવા વાડજ રાણીપ કોસ રોડ ડીમાર્ટ મોલની બહાર આર્વેડ ટ્રાન્સકયુબ પ્લાઝાના ઘાબા ઉપર સોલારના પ્લાન્ટ સોલાર પ્લાન્ટમાં પોલીકેબ કંપનીનો ૪ એમ.એમની સાઇઝનો ૩૨૧૦ મીટર કોપર વાયર કિમત રૂપિયા ૯૧,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.પી.પરમાર ચલાવે છે.

નારોલ: વિશાલભાઈ રામભાઈ નિકુંભ (ઉ.વ.૩૨) (રહે.દેવપ્રયાગ ફ્લેટ કોટેશ્વર રોડ મોટેરા) એ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૨/૧૮ સાજના ૭/૦૦ થી તા.૧૧/૧૨/૧૮ કલાક ૯/૩૦ વાગ્યા દરમ્યાન પીપળજ ગામ દેવરાજ એસ્ટેટ પ્લોટ નં.૧૪૭/૧૪૮ માં નુવુ કોનિયર પ્રાઇવેટ લિમીટેડ નામની કંપનીની ઓફીસમાં અજાણી વ્યક્તિ પ્રવેશ કરી લોખંડના કબાટનુ તાળુ તોડી રોકડ રૂપિયા ૧,૩૫,૦૦૦/- ચોરી કરી લઇ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જી.બ્રિદ યલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૪૦૯/૧૮

વાડજ: હરેશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૪૫) (રહે. ગાંધીનગર સોસાયટી સોરાબજી કમ્પાઉન્ડ જુના વાડજ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૨/૧૮ સાજના ૭/૩૦ વાગ્યાના સુમારે હરેશભાઈના પિતા મોહનભાઈ વાઘેલા જુના વાડજ હોટલ ડે ઈન સામે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે સ્વીફ્ટ કાર નંબર જીજે ૨૭ એએ ૦૪૮૨ ના ચાલકે કાર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા મોહનભાઈને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.કિશ્ચિન યલાવે છે.

“એ” ડીવીજન ટ્રાફીક પોલીસ સ્ટેશન: સ્મિતાબહેન હેમંતકુમાર વોરા (ઉ.વ.૬૫) (રહે. હેરીટન્સ એપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટી) તા.૧૧/૧૨/૧૮ સાજના ૭/૧૫ વાગ્યાના સુમારે હિમ્મતલાલ પાર્ક બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ સામે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા દ્વિચક્રી વાહનના ચાલકે વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા સ્મિતાબહેનને ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયું હતુ. આ અંગેની ફરીયાદ શોભનાબહેન નવનીધભાઈએ “એ” ડીવીજન ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.એમ.દેસાઈ યલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.